



Gujarat Public Service Commission

CORRIGENDUM

List of Eligible Candidates for Interview

Advertisement No. 119/2018-19

વંચાણે લીધી: (1) આયોગની તા:17.12.2019ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.

(2) આયોગની તા:09.11.2020ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી.

1. રાજ્ય સરકાર હસ્તકની મેડીકલ કોલેજ અને તેને સંલગ્ન તબીબી સંસ્થાઓમાં ફાર્માકોલોજી વિષયના ટ્યુટર,વર્ગ-2ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 119/2018-19 ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.01.09.2019ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગની ઉપર ક્રમ:(2) પર વંચાણે લીધેલ યાદીથી રૂબરૂ મુલાકાતને પાત્ર કુલ: 20 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.
2. નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પડતર SCA No.1035/2007ના આખરી ચુકાદાને આધિન, આયોગે બેઠક ક્રમાંક:101000040 ને સરકારી કર્મચારી તરીકે ઉપલી વય મર્યાદાનો લાભ આપી પાત્ર ગણવા નિર્ણય કરેલ છે. ઉક્ત ઉમેદવારનો બિન અનામત (કોમન) કેટેગરીની 01 જગ્યા સામે નોર્મ્સ મુજબ રૂબરૂ મુલાકાત માટે જરૂરી 06 ઉમેદવારો માટે નિયત થતા લાયકી ધોરણમાં સમાવેશ થતો હોવાથી, રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણી, "આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણ ધરાવે છે, પરંતુ, જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી" ની યાદીમાંથી રદ કરી, રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે.
3. ઉક્ત ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણતાં, બિન અનામત (કોમન) કેટેગરીની 01 જગ્યા સામે નોર્મ્સ મુજબ રૂબરૂ મુલાકાત માટે જરૂરી 06 ઉમેદવારો માટે નિયત થતા લાયકી ધોરણમાં બેઠક ક્રમાંક:101000091નો સમાવેશ થતો ન હોવાથી, રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણી, "જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે પરંતુ, આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણ ધરાવતા ન હોય, રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી"ની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. તથા આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની સંખ્યા 06 થાય છે.

4. આયોગની ઉપર ક્રમ :(2) પર વંચાણે લીધેલ યાદીથી પ્રસિધ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહે છે.

સ્થળ: ગાંધીનગર-382010
તારીખ: 05.02.2021

સંયુક્ત સચિવ
ગુજરાત જાહેર સેવા આયોગ